

SACHETA METALS LTD

(GOVT. RECOGNISED EXPORT HOUSE)

MFRR & EXPORTER OF ALU & ST. STEEL KITCHENWARE CUTLERY & HOUSEWARE ITEMS

REGD. OFFICE: BLOCK NO. 33, SACHETA UDYOG NAGAR, VILLAGE MAHIYAL, TALOD, SABARKANTHA, PRANTIJ,
GUJARAT, 383215

CORPO. OFF: SEJ PLAZA BLDG, 502/5TH FLOOR, MARVE ROAD, NEAR NUTAN SCHOOL, MALAD WEST, MUMBAI-
400064, MAHARASHTRA

TEL NO: 00 91 22 28725948 /

E-MAIL: sacheta@sacheta.com, WEB SITE: www.sacheta.com

CIN NO. L51100GJ1990PLC013784

Date: 27.01.2026

To,
The Listing Department,
BSE Limited,
P.J. Towers, Dalal Street,
Mumbai-400001

Security Code: - 531869

**Sub: Newspaper Publication of Unaudited financial results of the Company for the
quarter ended December 31, 2025.**

**Ref: Regulation 47(1) read with regulation 46(2)(g) of the SEBI (Listing Obligations
and Disclosure Requirements) Regulations, 2015.**

Dear Sir/Madam,

We herewith enclose copies of newspaper advertisement regarding extract of the Unaudited standalone financial results of the Company for the quarter ended December 31, 2025, published in (1) Free Press Gujarat (English) and (2) Lok Mitra (Gujarati) dated 25th January, 2026.

This is for your information and record.

Thanking you,
Yours faithfully,

For Sacheta Metals Limited

Pranav S. Shah
Executive Director
DIN:06949685

જો ખેતીમાં કુશળ આયોજન અને આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવે, તો ચોક્કસથી સફળ ‘સ્ટાર્ટઅપ’ વિકસાવી શકાય છે: ખેડૂત પુત્ર જય પટેલ

જો ખેતીમાં કુશળ આયોજન અને આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવે, તો ચોક્કસથી સફળ ‘સ્ટાર્ટઅપ’ વિકસાવી શકાય છે: ખેડૂત પુત્ર જય પટેલ



સુરત, પ્રકૃતિને ખીલવતી પ્રાકૃતિક પેઠી અપનાવી અનેક ખેડૂતોને સમૃદ્ધિની દિશા મળી છે. પ્રકૃતિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતાં ભારતમાં આજે પ્રાકૃતિક પેઠીએ નિશાન મોડમાં વેગ પકડ્યો છે. દક્ષિણ ગુજરાતની કળદુર્ગ ભૂમિમાં હવે ખેડૂતો માત્ર ડાંગર કે શેરડી પર નિર્ભર ન રહેતાં આધુનિક અને બજારલક્ષી પેઠી તરફ વળ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પરંપરાગત પેઠીની સાથે 'વેલ્યુ એડેડ' પેઠી અને ખેડૂતોની આવક બમણી કરવા પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે વાત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉમેજા ગામના છે ખેડૂત પ્રભાઈઓની જેમણે પ્રાકૃતિક પેઠીમાં પછા એક કદમ આગળ વધીને 'ફ્યૂયરિસ્ટિક ફાર્મિંગ' અપનાવ્યું છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ અને નિયમોને આધીન ઉમેજાના છે પ્રગતિશીલ ખેડૂત ભાઈઓએ ભવિષ્યના બજારનો તાગ મેળવના નીયતોનો વાવેતર કર્યું છે. જેના દ્વારા કુદરતી અને સ્વાસ્થ્યવર્ધક પીણું 'નીરા'નાં ઉત્પાદન અને વેચાણ થકી કરી રહ્યા છે મલબલ કમાણી. વર્ષોથી પેઠી સાથે જોડાયેલા ખેડૂત હેમંતભાઈ અને રાજેશભાઈ પહેલાના જણાવ્યા મુજબ આગઉ પરંપરાગત રીતે શાકભાજી, શેરડી, ડાંગરની પેઠી કરતા હતા. આજથી ૧૦ વર્ષ પહેલા પેઠીના શેઠે ૧૦ ખજૂરી વાવી હતા. જેમાં છેલ્લા પાંચ વર્ષથી શિયાળામાં નીરાનું ઉત્પાદન

શ્રાદ્ધ થવાથી માત્ર એક જ સિસ્ટનમાં સારી આપક મળી. એટલે આનાવાર દસ થી પંદર વર્ષનો વિચાર કરીને ૮ વીધામાં ૩૫૦૦ ખજૂરીની આવેલા વાવેતર કર્યું.


વધુમાં કહ્યું કે, આજની પેઢી જે કેમિકલયુક્ત દંડા પીણાં તરફ વળી છે. તેની સામે 'નીરો' એક શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ છે. હાલમાં દરરોજ ૧૦૦ ખજૂરીમાંથી દંદાજીત ૧૮૦ થી ૨૦૦ લીટર નીરોનો ઉતારો આવે છે. અને આગામી વર્ષ સુધીમાં દૈનિક ૧૦૦૦ થી ૧૨૦૦ લીટર ઉત્પાદનનો નિષ્કાર છે. સકારાત્મક માર્ગદર્શિકા મુજબ આરોગ્યવર્ધક નીરોનું વેચાણ થાય છે. વહેલી સવારની બારગોળી, નવસારી અને ખાસ કરીને વિદેશથી આવતા દ્રવ્યો

(બિનનિવાસી ભારતીયો) પણ આ શુદ્ધ અમૃત સમાન નીરો પીવા માટે આવે છે. આજના સમયમાં જ્યારે મોટાભાગના યુવાનો ડિઝીઝી મેજલીને લઈ પની નોકરીમાં બંધાવા માંગે છે, ત્યારે હંમેતાભાઈ પટેલના પુત્ર જય પટેલે એક નવો ચીલો ચીત્યો છે. જયે નોકરીની ચીલોમાં બદલે પોતાની ધરતી પર સ્વેદબિંદુ રેડીને 'એગ્રો-પ્રેન્ચોર' (ખેતી સાહસિક) બનાવતો પરદેશ પેતી છે. જય પટેલે કહ્યું હતું છે, એ પેતીમાં કુશળ આયોજન અને આધુનિક પ્રદત્તિ અપનાવવામાં આવે, તો ચોક્કસથી સફળ 'સ્ટાર્ટઅપ' વિકસાવી કાઢાય છે. જો રામડાનો યુવાન શિક્ષિત બનીને પેતીમાં પોતાનું કૌશલ્ય બતાવે, તો ભારત સાચા અર્થમાં કૃષિપ્રધાન દેશ બની રહેશે એમ માનવું પડે છે. ઉમેજના રહેવાસી ચેતનાભાઈ માટે શિયાળાની ઋતુમાં આ કુદરતી નીરો આશીર્વાદ સમાન છે. આરોગ્યને નિરોગી રાખતો નીરો પોટીન, ફેડરસ, કાર્બોલાઇટેડ્રસ, કોલ્ડચીયમ, કોસ્પરસ, લોલતલ, વિદામિન એ, બી અને સી તેમજ કલેકોરીઝ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. ખજૂરીમાંથી મળતો આ કુદરતી પાણી ઉર્જા અને આરોગ્ય

પ્રદાન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિવિધ મિનરલ્સ હોવાથી તેને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. નીરો રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચનતંત્ર માટે પણ ગુણકારી છે. સુરતના પ્રાગૈતિશીલ ભાઈઓની એ સાબિતી છે કે, ખેડૂત કંઈક નવું વિચારે, તો ખેતર એ ખેડોનો સોદો નહીં પણ સમૃદ્ધિનું દ્વાર છે. 'નીરા' જેવું શુદ્ધ અને કુદરતી પિણું લોકોના સ્વાસ્થ્યને પણ ખેડૂતના આર્થિક સ્વાસ્થ્યને સાથ સુધારી રહ્યું છે. સ્વાસ્થ્યવર્ધક 'નીરા'ને ખજૂરીના વૃક્ષમાંથી એકત્ર કરવાની કુશળ પદ્ધતિ સ્વાસ્થ્યવર્ધક નીરો એકત્ર કરવો સૌ પ્રથમ તંદુરસ્ત અને પુષ્ટ વ્યક્તિ ખજૂરીના વૃક્ષની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ ખજૂરીનું વૃક્ષના ઉપરના ભાગે પાંદડાંની નીચેના હિસ્સામાં સાવચેતીપૂર્વક છાલ ઉતારીને કાપ મૂકી છાલ સાચવ કરવામાં આવે છે. અને કાપેલ ભાગમાંથી રસ (નીરો) વહી શરૂ થાય તે માટે વાંસની કે લાકડાની નળ બેસાડવામાં આવે છે. નળીની નળે રસ જગણી મૂકીને માટીનું માટિયું અથવા સ્વચ્છ પાત્ર લટકાવવામાં આવે છે, જેમાં નીરો એકત્ર થાય છે. નળે હંમેશા વહેલી સાથે સુર્યોદય પહેલાં ઉતારી લેવામાં આવે છે.

આવે છે. હાલમાં દરરોજ ૧૦૦ જૂજીરીમાંથી અંદાજિત ૧૮૦ થી ૨૦૦ લીટર નીરાનો ઉતારો આવે છે. અને આગામી વર્ષ સુધીમાં દૈનિક ૧૦૦૦ થી ૧૨૦૦ લીટર ઉત્પાદનનો નિષ્કાર છે. સરકારની માર્ગદર્શિકા મુજબ આરોગ્યવર્ધક નીરાનું વેચાણ થાય છે.

આવે છે. હાલમાં દરરોજ ૧૦૦ જૂજીરીમાંથી અંદાજિત ૧૮૦ થી ૨૦૦ લીટર નીરાનો ઉતારો આવે છે. અને આગામી વર્ષ સુધીમાં દૈનિક ૧૦૦૦ થી ૧૨૦૦ લીટર ઉત્પાદનનો નિષ્કાર છે. સરકારની માર્ગદર્શિકા મુજબ આરોગ્યવર્ધક નીરાનું વેચાણ થાય છે.


પીરામલ ફાઇનાન્સ લિ. CIN:165910MH1984PLC032639
સુપરકર્ડ ઓફિસ સંખ્યા: બુનિંદ. ૨૦૧, ૭૩૯ માર્ગ, વિરામલ અમીતી બિલ્ડિંગ, વિરામલ અમલક બસપોર્ટે પાદ,
 કમ્પોઝી જંકશન, ૬૫૪૨ સેસીનગ માર્ગ, એલોમીયાન માર્ગ, વાલુકા (પિળા), મુન્નર - ૪૦૦૦૦૦, કોત.નં. ૯૫૧ ૨૨ ૩૮૨ ૪૦૦૦
 માર્ગના સંખ્યાના : ૪૦૦૨૧૧૧, બોર્ડો માર્ગ, તુલકોટ્ટેર, પંચવેલી કોડ રોડ, સી.કો. રોડ, અમદાવાદ-૩૮૦૦૦૮
 સંપર્ક વ્યક્તિ: (૧) ધીમેશ રાહોડા-૯૮૬૯૪૬૪૬૫૫૫, (૨) કમીશ વસીયા-૯૮૬૯૪૬૪૬૫૫૫, (૩) વસુક સુમર-૯૪૪૫૪૫૪૫૪૫

[illegible]

| કોલ કોડ/જામા/ ફિઝિકલ ગ્રાન્ટ/સહ- ઉદ્યમતાઈ(ખાનીઓ) | કીમાંક નોટીસની તારીખ અને રકમ | મિલકતનું સ્થળનામ | રજામત કિંમત | અને/અથવા મૂલ્ય કેપિટલ(કોમ્પાઉન્ડ) (કોમ્પાઉન્ડ)(આવક નો દર્શાવો) | બાકી બંધવી રકમ (૨૧.૦૧.૨૦૨૬) |
|---|--|---|--|---|--|
| Loan Code No.: HLSA00008689 સુરત-મજુરા જેટ (શાખા), રાયચંદ સામુદ્રીયા (ઉપારક્તની), લાયકદર્શ (સહ ઉપારક્તની-૧) | તા : ૦૩.૦૧.૨૦૨૪ રૂ. ૨૨,૯૪,૧૦૮/- (શ. બાવણ લાભ સોસાયટી દબાર એકેડેમી છ પુરા) | તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : સોસાયટી નં. ૧૩૩ થી ૧૩૮, ફેલેટ નં. બી-૩૦૨, રાજ રેસીડેન્સી, અલ્લાખા યામ ની પાસે, અલ્લાખા - ૩૮૫૦૧૦. ચતુઃસીમા : ઉત્તર : માછળ, દક્ષિણ : ફેલેટ નં. ૩૦૩, પૂર્વ : જગ્યા, સીડી, ફેલેટ નં. ૩૦૩, પશ્ચિમ : મુશ્કી જગ્યા અને શિલ્કીડી નં. એ. | રૂ. ૫૨,૨૦,૦૦૦/- (શ. બાવણ લાભ વીસ દબાર પુરા) | રૂ. ૧,૨૨,૦૦૦/- (શ. પાંચ લાભ બાંહેધરી દબાર પુરા) | રૂ. ૨૩,૭૨,૫૯૧.૪૮ (શ. તેથીસ લાભ ત્રણ દબાર પાંચસો એકસાઈ અને ઇસતાલીસ દબાર પુરા) |
| Loan Code No.: 04100008859 સુરત-મજુરા જેટ (શાખા), નરેશભાઈ લક્ષ્મણભાઈ કુશાર (ઉપારક્તની), મીનાબેન નરેશભાઈ કુશાર (સહ ઉપારક્તની-૧) | તા : ૨૨.૦૧.૨૦૨૪ રૂ. ૧૩,૫૭,૦૩૮/- (શ. તેર લાભ સોસાયટી દબાર ખાસકીસ પુરા) | તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્લોટ નં. ૮૧, મહાવીર ધામ રેસીડેન્સી, એનએ, શ્રીકો સુપર સ્ટોરની પાસે, આયુષ પ્રટેક્શન પાર્કની, સુરત સુપર સ્ટોરની પાસે, આયુષ પ્રટેક્શન પાર્કની, સાયબ - સીવર લેઇ, સીવર, અલ્લાખા, સુરત, ગુજરાત - ૩૮૫૦૧૦. ચતુઃસીમા : ઉત્તર : અન બ્લોક, દક્ષિણ : સોસાયટી રોડ, પૂર્વ : પ્લોટ નં. ૮૦, પશ્ચિમ : પ્લોટ નં. ૮૦, | રૂ. ૧૧,૨૦,૦૦૦/- (શ. અલ્લાખા લાભ વીસ દબાર પુરા) | રૂ. ૧,૧૨,૦૦૦/- (શ. એક લાભ દબાર પુરા) | રૂ. ૧૭,૧૮,૮૨૮.૮૫ (શ. ચાર લાભ ત્રણ દબાર એકસાઈ અને પચાસાઈ પુરા) |
| Loan Code No.: 04100004766 સુરત-મજુરા જેટ (શાખા) અનુભવભાઈ બાબુભાઈ અજની (ઉપારક્તની), બાબુભાઈ નાનજીભાઈ અજની (સહ ઉપારક્તની-૧) | તા : ૨૭.૧૨.૨૦૨૨ રૂ. ૬,૦૨,૩૩૬/- (શ. નર્મ લાભ એ દબાર ત્રણસો છત્રીસ પુરા) | તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્લોટ નં. ૩૮૨, ૬૫ થી રેસીડેન્સી - ૩, રામ વાહીકા રેસીડેન્સી ની બાબુભા, રામ વાહીકા રેસીડેન્સી, રામ વાહીકા રેસીડેન્સી સાથે, અલ્લાખા, સુરત, ગુજરાત - ૩૮૫૧૧૦. ચતુઃસીમા : ઉત્તર : પ્લોટ નં. ૩૮૨, દક્ષિણ : પ્લોટ નં. ૩૮૩, પૂર્વ : સાયબાઈની આંતરિક રોડ, પશ્ચિમ : પ્લોટ નં. ૩૮૫, | રૂ. ૬,૩૦,૦૦૦/- (શ. નર્મ લાભ વીસ દબાર પુરા) | રૂ. ૬૩,૦૦૦/- (શ. માલુ દબાર પુરા) | રૂ. ૧૨,૮૫,૪૪૧/- (શ. બાર લાભ પચાસાઈ દબાર ત્રણસો ઈકોસી પુરા) |
| Loan Code No.: MD098287 સુરત (શાખા), રાજેશ પટેલ (ઉપારક્તની), રીટા પટેલ (સહ ઉપારક્તની-૧) | તા : ૨૫.૦૧.૨૦૨૪ રૂ. ૬,૨૬,૧૩૫/- (શ. પાંચ લાભ સાયબીસ દબાર પાંચસો છત્રીસ પુરા) | તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : કુશન નં. ૧, પ્રાઇડ નં.૪૦૨, શિલ્કીડી નં. ૬, કુશન રેસીડેન્સી ની, બાંધકામ કરેલ પ્લોટ નં. ૩૦, ૩૧, ૩૨, ૩૩, સીવર રેસીડેન્સી સાથે, અલ્લાખા, સુરત, ગુજરાત - ૩૮૫૦૧૦. ચતુઃસીમા : ઉત્તર : પ્રયશ જેટ, દક્ષિણ : કુશન નં. ૨, પૂર્વ : આંતરિક રોડ, પશ્ચિમ : શિલ્કીડી નં. ૫૬,૧૫, | રૂ. ૬,૩૦,૦૦૦/- (શ. છ લાભ વીસ દબાર પુરા) | રૂ. ૬૩,૦૦૦/- (શ. ત્રેસલ દબાર પુરા) | રૂ. ૬,૪૬,૩૦૫/- (શ. છ લાભ સુકતાલીસ દબાર ત્રણસો પાંચ પુરા) |
| Loan Code No.: M0036043U સુરત (શાખા), દિનેશભાઈ કુશીયા (ઉપારક્તની), ઉપાધ્યક્ષ દિનેશભાઈ કુશીયા (સહ ઉપારક્તની-૧) | તા : ૨૭.૦૧.૨૦૨૫ રૂ. ૧૨,૧૮,૫૨૧/- (શ. બાર લાભ ત્રણ દબાર પાંચસો એકસાઈ પુરા) અને તા : ૨૭.૦૧.૨૦૨૫ રૂ. ૧૨,૧૮,૫૨૧/- (શ. બાર લાભ ત્રણ દબાર પાંચસો એકસાઈ પુરા) | તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : ફેલેટ નં. ૧૦૧, પહેલો ક્લોર, બી-વિંગ, શીવપા પેલેસ, લેડ નંદરીની અંદર, અમેસ રેસીડેન્સી પેલેસ, કામરેજ, સુરત, ગુજરાત - ૩૮૫૧૮૦. ચતુઃસીમા ઉત્તર : બેંગલોર પ્લોટ નં. ૩, દક્ષિણ : ને.એમ.દાર, પ્લોટ નં. ૩, પૂર્વ : સોસાયટી રોડ, પશ્ચિમ : બ્લોક નં. ૨,૧૫, | રૂ. ૧૧,૬૦,૦૦૦/- (શ. અલ્લાખા લાભ સાડીસ દબાર પુરા) | રૂ. ૧,૧૨,૦૦૦/- (શ. એક લાભ દબાર પુરા) | રૂ. ૧૦,૮૫,૩૮૧.૭૫/- (શ. બાર લાભ પચાસાઈ દબાર ત્રણસો એકસાઈ ઈકોસી તેસ પુરા) |
| Loan Code No.: HLSA00006DA53 & HLSA00006DA53TU, પેડા (શાખા), અશોકભાઈ બાબુભાઈ મુશ્કીયા (ઉપારક્તની), દેવલબેન અશોકભાઈ મુશ્કીયા (સહ ઉપારક્તની-૧) | તા : ૧૯.૧૧.૨૦૨૪ રૂ. ૧૨,૭૯,૦૨૦.૧૪/- (શ. બાર લાભ ઓગણસી દબાર ચીલ પુરા) અને તા : ૧૯.૧૧.૨૦૨૪ રૂ. ૩,૯૩,૯૦૮.૨૬ (શ. ત્રણ લાભ ત્રણ દબાર નવસો એસી અને છત્રીસ પાંચ પુરા) | તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : ફેલેટ નં. ૪૦૩, મોયો માથ અને એ - [વિંગ, વિશાખા આઈડી, આર.એસ. નં. ૨૮૩/૩ પીલી / પીડી પા, શીવસાઈત સાયબાઈની સાથે, કામરેજ, સુરત, ગુજરાત - ૩૮૫૦૧૦. ચતુઃસીમા : ઉત્તર : ઓસીસ અને વિશાખ આઈડી મેઈન રોડ, દક્ષિણ : જગ્યાનો ફેલેટ નં. એ-૪૦૨, પૂર્વ : ફેલેટ નં. એ-૪૦૨, પશ્ચિમ : ઓસીસ, ટીલેટ અને ફેલેટ નં. એ-૪૦૨, | રૂ. ૧૩,૧૦,૦૦૦/- (શ. તેર લાભ સાયબીસ દબાર પુરા) | રૂ. ૧,૩૫,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | રૂ. ૧૫,૪૫,૬૮૨.૪૩/- (શ. છ લાભ સુકતાલીસ દબાર નવસો બ્લોક અને તેસતીસ અને) |
| Loan Code No.: 064000006055, રાજકોટ (શાખા), હયોશા કેસર એસેસરીઝ (ઉપારક્તની), નમનકુમાર પરસોત્તમભાઈ તપાસીયા (સહ ઉપારક્તની-૧), પરસોત્તમભાઈ વનપારીયા પરસોત્તમભાઈ (સહ ઉપારક્તની-૨), જયોત્સનાબેન પરસોત્તમભાઈ વનપારીયા (જમીનદાર-૧) | તા : ૨૧.૧૧.૨૦૨૪ રૂ. ૬૬,૪૫,૬૫૪.૧૬/- (શ. છાસલ લાભ પિસતાલીસ દબાર છસો ચોળ અને સોળ પેસા પુરા) | તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, ઓસીસ નં. ૧, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | રૂ. ૮૦,૬૦,૭૭૫.૫૬/- (શ. એસી લાભ સાડીઠ દબાર ત્રણસો પંચોતેર અને ઓગણસાડી પેસા પુરા) |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૨, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૩, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૪, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૧, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૨, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૩, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૪, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૧, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૨, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૩, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૪, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૧, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૨, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૩, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૪, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૧, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૨, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૩, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૪, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૧, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૨, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૩, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૪, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૧, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૨, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૩, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૪, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૧, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૨, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૩, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | |
| તમામ ભાગ અને હિસ્સા સાથેની વિલકત : પ્રાઇડ ફ્લોર, કુશન નં. ૪, પ્લોટ નં. ૧, ગોલ્ડ પાર્ક, રાધે માર્બલ, માંગરોળ રોડ, કેશોદ, સર્વે નં. ૦૭૪/ખી, નિલ માપવ, જુનાગઢ, ગુજરાત - ૨૬૨૨૨૦. | | | રૂ. ૧૩,૭૦,૦૦૦/- (શ. તેર લાભ તિસર દબાર પુરા) | રૂ. ૧,૩૦,૦૦૦/- (શ. એક લાભ પાંચસ દબાર પુરા) | </ |

ઈ-ઢરાજીની તારીખ અને સમય : રફ.૦૨.૨૦૨૩, સપ્તાહે ૧૧.૦૦ થી બપોરે ૧.૦૦ કલાકે (૫ મિનિટના અમશદિત વઢારા સાથે)
 ળિડ સળમીઢ કપવાની છેલ્લી તારીખ : રફ.૦૨.૨૦૨૩ ના રેપ સપ્તાહે ૩.૦૦ વાગ્યા સુધી

વેચાણના નિયમો અને શરતો નીચે મુજબ છે અને કુળા કડીને નીચેની લિંક સપનામું : www.piramal.auction.com/b-auction.html or email us on piramal.auction@piramal.com પર વિતરો પછા આપવામાં આવી છે.

ઉપરોક્ત ઉપદાતાનું / જામીનદારને આમી કચ્છ ૧૩(૮) નોટીસમાં દર્શાવેલ રકમ કરાજીની મારીમ મુખી સુરેન્દ્ર પાંચલજી વગેરે સાથે ચુકવવાની ચુકવના આવામાં આમ છે જે નિર્ણય કરવાનો ઉપદાતાનું / જામીનદારની વિચકતની રાજીવ / વેપાર કરવામાં આવેલ અને પામી લેલું છે જે કોઈ વેપાર નો વ્યાજ સાથે ચુકવવામાં આવેલ.

આમી ઉપદાતાનું મુખ્ય અંકરક અને આમ છે જે જાણવેલ સાથે મારફતમાં વેપાર કચ્છ (૮) થાક કચ્છ ૨ અને ૩ સરકારી સહી હેઠળ નોંધે તમામી સુરિશ્ત વિચકતના બાકી સહી ભરપૂરું કરી પાછી મેળવી કાઢો છો. ખાસ કરી તે ઉપદાતાઓનું અને સામાન્ય રીતે જનતાને કૃપા કરી નોંધે તે કો જે અહીં નિષ્પાટી કરવા કરેલો નિષ્પાટ નિર્ણય થયે તો સુરિશ્ત લેખકરાર પાસની સંધિ કરવા તેની લાગુ કરી કરે છે.

તારીખ : ૨૫.૦૧.૨૦૨૬
સ્થળ : ગુજરાત

સહી/ (સહિત્ત અધિકારી),
પીરમા સુરિશ્ત લેખકરાર મેડીટેડ



અમદાવાદ, સ્પોર્ટ્સ ઓથોરિટી (૩૭.૭૮ સેકંડ) સ્પર્ધાઓમાં ત્રણ ઓફ ગુજરાત દ્વારા. “ગુજરાત રાજ્ય મેલ હાકુંબ ઈસ” અંતર્ગત ૧૮ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન વડોદરામાં રાજ્યસ્તરીય સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યખરના વિવિધ જિલ્લાઓ તથા સંસ્થાઓના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લઈ પોતાની રમત પ્રતિબાધનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં પશ્ચિમ રેલવેના મંગળ રેલ પ્રબંધક કાર્યાલય, અમદાવાદમાં કાર્યરત ત્રણ રેલ કર્મચારીઓએ શાનદાર પ્રદર્શન કરીને ગૌરવપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી હતી. કાર્યાલય અધિક્ષક શ્રી જયદેવ જયેન્દ્ર શુક્લાએ ૫૦ મીટર ફી સ્ટાઈલ (૨૮.૮૧ સેકંડ), ૧૦૦ મીટર ફી સ્ટાઈલ (૧ મિનિટ ૦૬ સેકંડ) તેમજ ૫૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક

હતું. રાજ્યસ્તરીય સ્પર્ધામાં પશ્ચિમ રેલવે, અમદાવાદ મેંડળના આ ત્રણેય કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ તેમની કઠોર મહેનત, પ્રતિભા તથા રમત પ્રત્યેના સમર્પણનું ઉત્તમ (ઉદાહરણ) છે.

| SACHETA METALS LIMITED CIN: L51100G1990PLC013784 Regd. Office : Block No. 33 Sacheta Udyog Nagar, Vill: Mahiyal, Tal: Talod, Dist: Sabarkantha, Gujarat 383215 | | | | | | |
|---|---|---------------|---------------|---------------|---------------|------------|
| EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31ST DECEMBER, 2025 (Rs. In Crores) | | | | | | |
| SR. NO. | PARTICULARS | QUARTER ENDED | QUARTER ENDED | QUARTER ENDED | CORRESPONDING | YEAR ENDED |
| | | 31.12.2025 | 30.09.2025 | 31.12.2024 | 31.12.2025 | 31.03.2025 |
| | | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Audited |
| 1 | Total Income from Operations | 21.39 | 21.11 | 25.68 | 63.27 | 91.91 |
| 2 | Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | 1.02 | 0.68 | 0.90 | 2.23 | 2.82 |
| 3 | Profit/ (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items) | 1.02 | 0.68 | 0.90 | 2.23 | 2.82 |
| 4 | Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items) | 0.77 | 0.50 | 0.67 | 1.67 | 2.10 |
| 5 | Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)) | 0.77 | 0.50 | 0.67 | 1.67 | 2.10 |
| 6 | Equity Share Capital | 25.00 | 25.00 | 25.00 | 25.00 | 25.00 |
| 7 | Reserves (excluding Revaluation Reserve as shown in the Balance sheet of previous year) | - | - | - | - | 26.71 |
| 8 | Earning Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations) | - | - | - | - | - |
| | Basic : | 0.06 | 0.04 | 0.05 | 0.13 | 0.17 |
| | Diluted : | 0.06 | 0.04 | 0.05 | 0.13 | 0.17 |

Note

1 The above is an extract of unaudited financial results for the quarter ended 31st December, 2025. The financial results were
2 reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors
3 at its meeting held on 24th January 2026.

4 The figures of the last and prior corresponding periods are balancing figures between audited figures in respect of the full financial year and published
5 year-end date figures upto "third quarter of the current financial year."

6 The Statement has been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") prescribed under section 133 of
the Companies Act, 2013 and "in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements)
Regulations, 2015 (SEBI Regulations).

The Company is operating in single segment i.e. Aluminium products. The company has changed its object by addition of
Real Estate Business activities in the main object in the EGM held on 16th May, 2024. However, there is no revenue from
operation during the quarter ended December, 2025 from these sources. So segment reporting is not applicable to company.
The company has divided its equity shares of face value of Rs. 10 into equity shares of face value of Rs. 2 each,
as approved by the shareholders at the AGM held on 28/09/2024. Earnings Per Share (EPS) for all periods presented has been
restated in accordance with Ind AS 33 to give effect to the subdivision.

Figures of the previous period/quarter have been regrouped wherever necessary.



For Sacheta Metals Ltd
Sd/-
Satishkumar K. Shah
Managing Director
DIN: 00237283

| <h1 style="text-align: center;">ASHISH POLYPLAST LIMITED</h1> | | | | | |
|---|--|---------------|------------------|---------------|------------|
| <p style="text-align: center;">Regd. Office: 501, Fortune Business Hub, Nr. Shell Petrol Pump, Science City Road, Ahmedabad-380060 Phone : 9099052582, E-Mail: ashishpolyplast@gmail.com CIN : L17110GJ1994PLC021391</p> | | | | | |
| <p style="text-align: center;">Extract of Statement of Unaudited Financial Results for the Quarter ended December 31, 2025 (Rs in Lakhs Except Earning Per Share)</p> | | | | | |
| Sr. No. | Particulars | Quarter ended | Nine month ended | Quarter ended | Year ended |
| | | 31.12.2025 | 31.12.2025 | 31.12.2024 | 31.03.2025 |
| | | Unaudited | Unaudited | Unaudited | Audited |
| 1 | Total income from operations (net) | 354.23 | 1,097.12 | 446.58 | 1,601.44 |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and Extraordinary items) | 19.46 | 57.28 | 0.01 | 38.08 |
| 3 | Net profit / (Loss) for the period before Tax (after Exceptional and Extraordinary items) | 19.46 | 57.28 | 0.01 | 38.08 |
| 4 | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and Extraordinary items) | 15.17 | 47.10 | 2.13 | 24.78 |
| 5 | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 14.90 | 46.32 | 1.83 | 23.62 |
| 6 | Equity share capital (face value of INR 10) | 339.75 | 339.75 | 339.75 | 339.75 |
| 7 | Reserve excluding Revaluation Reserve | | | | 331.99 |
| 8 | Earning per share (before and after extraordinary items) | 0.45 | 1.39 | 0.06 | 0.73 |

Notes:

1 The above is an extract of the detailed format of Quarterly Financial Results filled with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations 2015. The full format of Quarterly Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and also on the Company's Website www.ashishpolyplast.com.

2 Above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on January 23, 2026.

By order of the Board
Sd/-
Ashish D Panchal
Chairman & Managing Director
DIN : 00598209

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLICATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLICATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad.
Editor : Mayur C. Bhatt

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLICATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLICATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad.
Editor : Mayur C. Bhatt